




અમદાવાદ મહાનગરપાલિકા



અમદાવાદ

સેન્ટ્રલ ઓફીસ ખાતુ
માહિતી (મેળવવાનો) અધિકાર
અધિનિયમ - ૨૦૦૫



પ્રકરણ-૨ નિયમ ૪(૧)ખ ની જોગવાઈ મુજબ
શ્રી.એન.જે.માલવીયા, જી.એ.એસ
ડે.મ્યુનિસિપલ કમિશનર(વહીવટ)

ફોન ઓફીસ : ૨૫૩૯૧૮૫૪

૨૫૩૯૧૮૧૧ Ext. ૭૭૪



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફિસ
પ્રકરણ ૩ (નિયમ સંગ્રહ -૨) અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો.

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
૧.	મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમાર આઈ.એ.એસ.	બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ મુજબ	ઓફર/કવોટેશનની સત્તા શિડ્યુલ થેપ્ટર-૫ રૂલ- ૨(૨) મુજબ રૂા. ૩૦૦૦૦૦/- ટેન્ડરની સત્તા કલમ ૭૩(ક) મુજબ રૂા. ૧૫૦૦૦૦૦/-	-	મ્યુનિ. કોર્પો.નાં સર્વોચ્ચ વહીવટી વડા હોવાથી મ્યુ. કોર્પોનો તમામ વહિવટ તેઓના નામે ચાલે છે.
૨.	ડે.મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) શ્રી એન જે માલવીયા જી.એ.એસ	❖ સેન્ટ્રલ ઓફિસના કર્મચારીઓની સર્વિસબુક રીઓપન કરવા ❖ સેન્ટ્રલ ઓફિસના કર્મચારીના બાકી મ્યુનિસિપલ લેણાં નિવૃત્તીના લાભોમાંથી વસૂલ લેવા ❖ સેન્ટ્રલ ઓફિસના કર્મચારીના સ્ટેગર્ડ ઈન્ક્રીમેન્ટ મંજૂર કરવા ❖ સેન્ટ્રલ ઓફિસના કર્મચારીએ સીક્યુરીટી બોન્ડ ન આપેલ હોય તો વેવ કરવા તેમજ ડીલે કોન્ડોન કરવા ❖ કોર્પોરેશનની નીતી અનુસાર કર્મચારીઓના મેડીકલ રીએમ્બર્સમેન્ટ બીલોની ચૂકવણી માટે મંજૂરી આપવી ❖ ડ્રાઈવરોના ઓવરટાઈમની મંજૂરી	ઓફર/કવોટેશનની સત્તા શિડ્યુલ થેપ્ટર-૫ રૂલ- ૨(૨) મુજબ રૂા. ૧૨૫૦૦૦/- ટેન્ડરની સત્તા કલમ ૭૩(ક) મુજબ રૂા. ૫૦૦૦૦૦/-	-	સેન્ટ્રલ ઓફિસ સહીતની મ્યુ. કોર્પોની કોમન કેડરની વ્યવસ્થા પર્સોનલ પોલીસી, માનવ સંસાધન વિકાસ, ઓફિસર તથા કર્મચારીઓની ટ્રેઈનીંગ સંબંધીત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અપાયેલ મંજૂરી સંદર્ભે ભરતી, બઢતી તથા બઢલીની કાર્યવાહી કરવી.
૩.	આસી.મેનેજર શ્રી નિલેષ સી. પટેલ એમ્પ્લોઈ નં.૭૦૨૨૯	❖ શિરસ્તેદાર ધ્રાંચ ❖ હેડ કલાર્ક (જનરલ), રજીસ્ટ્રી ધ્રાંચ ❖ સંકલન વિભાગ (બોર્ડ/કમિટી) ❖ રોસ્ટર વિભાગ ❖ હેડ ડ્રાઈવર	❖ રૂા. ૨૫૦/- સુધીનો કન્ટ્રીજન્સી ખર્ચ કરવાની સત્તા ❖ રૂા. ૨૫૦/- સુધીના	ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફિસની જીડીઈએસટી નં. ૯૫૦૭ મુજબની ધ્રાન્ચોની ફાઈલોની ચકાસણી કરીને સક્ષમ સત્તા સમક્ષ મંજૂરી અર્થે મુકવાની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
		<ul style="list-style-type: none"> ❖ કંટ્રોલરૂમ ❖ સેન્ટ્રલ ઓફીસના હેડક્લાર્ક, શિરસ્તેદાર, સંકલન અધિકારીશ્રી ઉપર વહીવટી દેખરેખ ❖ સેન્ટ્રલ ઓફીસના સ્ટાફની સાત દિવસની કેજયુઅલ રજા મંજૂર કરવાની સત્તા ❖ કામગીરી સંતોષકારકનું સર્ટીફિકેટ આપવા ❖ ગેઝેટ તથા મેમોરેન્ડમ ઓફ મેરેજ, એફીડેવીટના આધારીત કર્મચારીઓના નામમા ફેરફાર કરવાના ઠરાવ કરવાની ❖ ફરજના સમય અથડામણમાં આવતો ન હોય તો કર્મચારીઓને વધુ અભ્યાસ કરવાની મંજૂરી આપવાની ❖ નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ ઇસ્યુ કરવાની ❖ મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી મળ્યા બાદ ઠરાવ ઇસ્યુ કરવાની ❖ કર્મચારીઓની અન્ય સંસ્થામાં અરજી ફોરવર્ડ કરવાની 	એડજસ્ટમેન્ટ ખર્ચના		
૪.	આસી.મેનેજર શ્રી કિરણકુમાર જે. વનાલીયા એમ્પ્લોઈ નં. ૭૦૨૪૫ (ફાળવણીથી નિમણૂક)	<ul style="list-style-type: none"> ❖ ઇન્ટરવ્યુ બ્રાંચ ❖ વેલ્ફેર બ્રાંચ ❖ સિક્યુરીટી બ્રાંચ તેમજ સેમીનાર તાલીમ ❖ બીલકલાર્ક અને ઇમ્પ્રેશ કેશ ❖ વોચમેન ❖ ઇન્ડીમેન્ટ મંજૂર કરવાની સત્તા (હેડક્લાર્ક, શિરસ્તેદાર, સંકલન અધિકારી, ઓ.એસ., તેમજ વેલ્ફેર ઓફીસર સિવાય) ❖ ખર્ચની મંજૂરી મળેલ બિલોમા ખાતાના અધિકારી તરીકે સહી કરવાની 	<ul style="list-style-type: none"> ❖ રૂ. ૨૫૦/- સુધીનો કન્ટીજન્સી ખર્ચ કરવાની સત્તા ❖ રૂ. ૨૫૦/- સુધીના એડજસ્ટમેન્ટ ખર્ચના 	ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસની જીડીઈએસટી નં. ૯૫૦૭ મુજબની બ્રાન્ચોની ફાઈલોની ચકાસણી કરીને સક્ષમ સત્તા સમક્ષ મંજૂરી અર્થે મુકવાની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાણાકીય સત્તા	અન્ય	ફરજો
૫.	શિરસ્તેદાર શ્રી કાંતિભાઈ બી પ્રજાપતિ એમ્પ્લોઈ નં. ૮૦૫૧			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ખાતાઓની વર્ગ ૧ થી ૪ ના અધિકારીઓ / કર્મચારીઓની નિમણૂક બદલી અને બઢતી અંગેની કામગીરી, ખાનગી અહેવાલ બ્રાન્ચની કામગીરી, ડીપાર્ટમેન્ટલ પરીક્ષાની કામગીરી, એસ્ટાબ્લીસમેન્ટ બ્રાન્ચની કામગીરી, કર્મચારીઓ / અધિકારીઓને ટ્રેનિંગમાં મોકલવા અંગેની કામગીરી
૬.	સંકલન અધિકારી (બોર્ડ - કમિટી) શ્રી ભરતભાઈ આર.સોલંકી એમ્પ્લોઈ નં. ૮૬૮૪			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી કમિટીઓ, સ્ટે.કમિટી તથા મ્યુનિસિપલ બોર્ડમાં સંકલનની કામગીરી તથા કમિટી તથા બોર્ડમાં હાજર રહેવું. તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રી દ્વારા મ્યુનિસિપલ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો જે તે ખાતામાં મોકલી જે તે ખાતા મારફતે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી જવાબ કરાવવાની કાર્યવાહી કરવી. તેમજ રોસ્ટરબ્રાંચને લગતા અભિપ્રાય આપવા તથા રોસ્ટરને લગતી માહિતી રાજ્ય સરકારમાં મોકલવી.
૭.	વેલ્ફેર ઓફીસર/ઓ.એસ શ્રી રઘુભાઈ એન.પાંડોર એમ્પ્લોઈ નં. ૮૫૭૮			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીના આશ્રિતને રાજ્ય સરકારના નીતી નિયમો અનુસાર નાણાકીય સહાય આપવા મંજૂરી મેળવવાની કામગીરી તથા મેનહોલ/ગલીટ્રેપ ખાતાના વર્ગ-૪ના કર્મચારીઓના મરણ/ અનફિટ કેસમાં નોકરી આપવા અંગે તથા આનુષંગિક કાર્યવાહી, લેડીઝરૂમ તથા ધોડીયાધરની ટેબરેબની તથા માલસામાન પૂરી પાડવાની કામગીરી, ઇમ્પ્રેશ કેશના બીલો ચેક કરવાની કામગીરી, સેન્ટ્રલ ઓફીસ ખાતે ફરજ બજાવતા વર્ગ ૧ થી ૪ કર્મચારીઓના પગાર બીલોની માહિતી તથા સીક્યુરીટી બ્રાંચની કામગીરી
૮.	ઓ.એસ. (ઈન્ટરવ્યુ બ્રાંચ) શ્રી વિજયભાઈ આર પટેલ એમ્પ્લોઈ નં. ૮૪૮૮			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ઈન્ટરવ્યુ બ્રાંચની કામગીરી મ્યુનિ. કોર્પો. દ્વારા કરવામાં આવતી તમામ ભરતી અંગેની સક્ષમસત્તાની મંજૂરી મેળવી જાહેર ખબર આપવી તથા લેખિત તેમજ મૌખિક પરિક્ષા લેવી, ઉમેદવારના સર્ટી ચેક કરવા તથા નિમણૂકના હુકમ તૈયાર કરવા તથા વહિવટી સુધારણા સેલની કામગીરી
૯.	હેડક્લાર્ક (ઈન્ટરવ્યુ બ્રાંચ) શ્રી દિપકભાઈ એ કટારા એમ્પ્લોઈ નં. ૮૫૦૨			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતાના જુદા જુદા ખાતાની ખાતાની માંગણી મુજબ જગ્યાઓ જાહેર ખબર આપી ભરવા મંજૂરી મેળવી જાહેર ખબર આપવાની કાર્યવાહી કરવી, જાહેર ખબરના અનુસંધાને આવેલ અરજીઓની લાયકાત મુજબ ચકાસણી કરવાની, તેમજ તે અંગે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી ઈન્ટરવ્યુ ગોઠવવાની કામગીરી, ઈન્ટરવ્યુમાં આવેલ ઉમેદવારોના અસલ સર્ટીફિકેટ ચેક કરવાની કામગીરી, તેમજ ઈન્ટરવ્યુ બાદ સ્ટાફ સિલેક્શન કમિટીની સૂચના મુજબ પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવી સ્ટાફ સિલેક્શન ઠરાવ પાડવાની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
૧૦.	હેડક્લાર્ક શ્રી સોમભાઈ જી રાઠવા એમ્પ.નં-૮૫૫૧			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સ્કેનીંગ તથા હેડક્લાર્ક(જનરલ)ની રજા દરમ્યાન તથા મદદની કામગીરી તથા હેડ કલાર્ક (સીક્યુરીટી)શ્રીની મદદમાં કામગીરી
૧૧.	હેડ કલાર્ક (રોસ્ટર) શ્રી સોમભાઈ જી રાઠવા એમ્પ.નં-૮૫૫૧			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓમાં આવેલ વર્ગ ૧ થી ૪ ની જગ્યાઓના રોસ્ટર રજીસ્ટર નિભાવવા, સેમીનાર અંગે દરખાસ્ત કરવી, રાજ્ય સરકાર દ્વારા રોસ્ટરના અનુસંધાને માંગવામાં આવતી માહિતી નિયત ફોર્મમાં સક્ષમ સત્તાની મંજૂરી મેળવી પૂરી પાડવી.
૧૨.	ઈન્ચાર્જ હેડક્લાર્ક (જનરલ) શ્રી વિજય કે પંડ્યા એમ્પ ન ૮૧૬૧			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને આવતી ટપાલો સંબંધિત ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ મુકવાની કામગીરી, સેન્ટ્રલ ઓફીસના કર્મચારીઓના હકકરજા, સી.એલ, હાજરીપત્રકનુ સુપરવીઝન , તથા સેન્ટ્રલ ઓફીસના સરકારી પત્રોના જવાબ કરવાની કાર્યવાહી,
૧૩.	હેડ કલાર્ક (શ્રી પાઉલભાઈ વસાવા-ફાળવણી) સીક્યુરીટી બ્રાંચ એમ્પ.નં-૮૪૮૮			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેશનની મિલકતો, નાકાઓ, ઝોનલ ઓફીસો વગેરેની દેખરેખ અને સાચવણી માટે સીક્યુરીટી કંપનીઓને કોન્ટ્રાક્ટથી રાખવામાં આવે છે. તે સીક્યુરીટી કંપનીના બીલોની પોઈન્ટ વાઈઝ ચકાસણી કરીની બીલની મંજૂરી મેળવવાની તેમજ મંજૂરી મળે તેને પેમેન્ટ કરવાની કામગીરી
૧૪.	સીનીયર કલાર્ક (સંકલન) ધીરેન કે.શાહ એમ્પ.નં-૬૭૮૫			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટાઉન પ્લાનીંગ કમિટી, એસ્ટેટ કમિટી, હાઉસીંગ કમિટી, રીક્રીએશન કમિટીમાં સંકલનની કામગીરી
૧૫.	જુનીયર કલાર્ક (સંકલન) લલીતભાઈ પટેલ (ફાળવણી) એમ્પ.નં- ૮૮૩૨ (સીનીયર કલાર્કની જગ્યા ખાલી)			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટી, હેલ્થ કમિટી, હોસ્પિટલ કમિટી, રેવન્યુ કમિટી, વોટર સપ્લાય કમિટી, રોડ અને બિલ્ડીંગ કમિટી તથા લીગલ કમિટીમાં સંકલનની કામગીરી
૧૬.	સીનીયર કલાર્ક (સીક્યુરીટી બ્રાંચ) શ્રી શૈલેષભાઈ કે મોદી એમ્પ્લોઈ નં. ૬૮૨૦			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	જુદી જુદી સીક્યુરીટી કંપનીના આવતા બીલોની પોઈન્ટ વાઈઝ ચકાસણી કરીને ખતવણી કરવાની કામગીરી, બીલોનું સ્ટેટમેન્ટ બનાવવાની કામગીરી, જરૂરીયાત મુજબ જે તે જગ્યાએ સીક્યુરીટી મુકવા તેમજ બંધ કરવા સીક્યુરીટી કંપનીને જાણ કરવા તેમજ એસ્ટેટ / ટી.ડી.ઓ ખાતા દ્વારા ગેરકાયદેસર બાંધકામ માટે મુકવામાં આવતી સીક્યુરીટી અંગેનો ચાર્જ વસૂલ લેવા અંગેની ગણતરી કરી ટી.ડી.ઓ / એસ્ટેટ ખાતાને જાણ કરવી.તેમજ બીલો બનાવવા.
૧૭.	જુનીયર કલાર્ક શિરસ્તેદાર બ્રાંચ			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય	આસી.મેનેજરશ્રી (સે.ઓફીસ) તથા શિરસ્તેદારશ્રી (સેન્ટ્રલ ઓફીસ)ને સંબોધીને આવતી ખાતાકીય તથા સરકારી અરજીઓ, ટપાલ, તથા ફાઈલોનું

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
	શ્રી ભુમિકા પી દેસાઈ એમ્પ્લોઈ નં. ૯૬૩૭			કામગીરીઓ	ઈન્વર્ડ આઉટવર્ડ પોસ્ટેજ રજીસ્ટર તથા ઈન્ટરવ્યુ બ્રાંચની ટપાલની કામગીરી
૧૮.	જુનીયર કલાર્ક શિરસ્તેદાર બ્રાંચ શ્રી ક્રિસ્ટાઈન એસ કિશ્ચિયન એમ્પ્લોઈ નં. ૭૩૧૧૦			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	આસી.મેનેજરશ્રી (સે.ઓફીસ) તથા શિરસ્તેદારશ્રી (સેન્ટ્રલ ઓફીસ)ને સંબોધીને આવતી ખાતાકીય તથા સરકારી અરજીઓ, ટપાલ, તથા ફાઇલોનું ઈન્વર્ડ આઉટવર્ડ પોસ્ટેજ રજીસ્ટર તથા ઈન્ટરવ્યુ બ્રાંચની ટપાલની કામગીરી
૧૯.	શ્રી સલમાન ખાલીદી જુ. બીલ કલાર્ક એમ્પ્લોઈ નં. ૭૩૪૦૧ (ફાળવણી)			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસમાં ફરજ બજાવતા અધિકારીશ્રી / કર્મચારીઓના પગારના ડેટા ભરવાની , પગારબીલો પાસ કરાવી પેમેન્ટ કરવાની, ઈન્કીમેન્ટ કરવાની, રજાઓ અંગેના એસ.બી.એલ.આર કરવા તથા પરચૂરણ બિલો બનાવવાની કામગીરી
૨૦.	શ્રી દિપેન ગાંધી જુ. બીલ કલાર્ક એમ્પ્લોઈ નં. ૯૧૧૪			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસમાં ફરજ બજાવતા અધિકારીશ્રી / કર્મચારીઓના પગારના ડેટા ભરવાની , પગારબીલો પાસ કરાવી પેમેન્ટ કરવાની, ઈન્કીમેન્ટ કરવાની, રજાઓ અંગેના એસ.બી.એલ.આર કરવા તથા પરચૂરણ બિલો બનાવવાની કામગીરી
૨૧.	સીનીયર કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી ફાલ્ગુની વાય દેસાઈ એમ્પ્લોઈ નં. ૮૬૯૮			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓમાં જગ્યા ભરવા ટૅનિક વર્તમાન પત્રમાં જાહેર ખબર દ્વારા તથા ખાતાકીય સરકયુલર કરી મંગાવેલ અરજીઓ ઈન્વર્ડ કરવી, તેના પત્રકો બનાવવા
૨૨.	જુ. કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી અંકિત કાનડે એમ્પ્લોઈ નં. ૭૨૮૩૨				(ટેક્ષ ખાતે ફાળવણી)
૨૩.	સીનીયર કલાર્ક (સંકલન વિભાગ બોર્ડ કમિટી વિભાગ) જગ્યા ખાલી			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટાઉન પ્લાનીંગ કમિટી, એસ્ટેટ કમિટી, હાઉસીંગ કમિટી, રીકીએશન કમિટીમાં સંકલનની કામગીરી
૨૪.	સીનીયર કલાર્ક ઈમ્પ્રોશ કેશ શ્રી જયેશભાઈ પટેલ એમ્પ્લોઈ નં. ૮૨૬૯			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા કરવામાં આવતા તથા સેન્ટ્રલ ઓફીસ દ્વારા કરવામાં આવતા રોજ બરોજના ખર્ચની ચૂકવણી તથા સેન્ટ્રલ ઓફીસના કર્મચારીઓના મેડીકલ રીઈમ્બર્સમેન્ટ બીલોની કામગીરી તથા ઈમ્પ્રોશ કેશ રજીસ્ટર નિભાવવું

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
૨૫.	સીનીયર ક્લાર્ક એસ્ટા.બ્રાંચ (ખાલી જગ્યા)			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	છ માસ માટે હંગામી જગ્યા ઉઘાડવાની કામગીરી તથા જગ્યાઓ કાયમ કરવા દરખાસ્તની કામગીરી તથા વર્ગ ૧ અને વર્ગ ૨ ના અધિકારી / કર્મચારીઓના પ્રોપર્ટી રીટર્નની માહિતી મંગાવવી ને ફોર્મ એકત્રિત કરવા
૨૬.	ડે.શિરસ્તેદાર (જનરલ) સીનીયર ક્લાર્ક શ્રી રજનીકાંત એસ.પટેલ એમ્પ્લોઈ નં. ૮૨૪૨			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	જુદી જુદી કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૪ ના અધિકારી / કર્મચારીઓના રાજીનામા, સ્વૈ.નિવૃત્તિ, નામમાં ફેરફાર, અરજી ફોરવર્ડ, એન.ઓ.સી., વધુ અભ્યાસ, સ્ટડી લીવ, તથા વર્ગ ૪ ના કર્મચારીઓના બદલી / બઢતી / નિમણૂક અંગેની કામગીરી
૨૭.	ડે.શિરસ્તેદાર (ટેકનીકલ) સીનીયર ક્લાર્ક શ્રી અલ્પેશ એમ મહેતા એમ્પ્લોઈ નં. ૮૬૬૨			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટેકનીકલ કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૩ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસડેટા, બદલી, નિમણૂક બઢતી અંગેની કામગીરી
૨૮.	ડે.શિરસ્તેદાર (વહીવટ) સીનીયર ક્લાર્ક શ્રી ભરતભાઈ આઈ પટેલ એમ્પ.નં- ૮૪૦૫			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	વહીવટી કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૩ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસડેટા, બદલી, નિમણૂક બઢતી અંગેની કામગીરી
૨૯.	સીનીયર ક્લાર્ક એ.સી.આર બ્રાંચ, એસ્ટા.બ્રાંચ તથા સરક્યુલર, ઓફીસઓર્ડર શ્રી કલાવતી હરેન મહેતા એમ્પ્લોઈ નં. ૮૩૫૮			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા કરવામાં આવતા પરિપત્રો તથા ઓફીસ ઓર્ડર ઇસ્યુ કરવા તથા વેબસાઈટ ઉપર મુકાવવા તેમજ વર્ગ ૧ થી ૩ ના કર્મચારીઓના વર્ષવાઈઝ વાર્ષિક ખાનગી અહેવાલ રીપોર્ટ નિભાવવા તથા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા બીજા વિભાગો (ખાતાકીય સિવાય) સાથે કરવામાં આવતા પત્રવ્યવહારનું આઉટવર્ડ રજીસ્ટર તથા તેમના મોબાઈલ તથા ધરના ટેલીફોનના બીલોની બીલ બનાવી ચૂકવણી કરવાની કામગીરી ; છ માસ માટે હંગામી જગ્યા ઉઘાડવાની કામગીરી તથા જગ્યાઓ કાયમ કરવા દરખાસ્તની કામગીરી વર્ગ ૧ અને વર્ગ ૨ ના અધિકારી / કર્મચારીઓના પ્રોપર્ટી રીટર્નની માહિતી મંગાવવી ને ફોર્મ એકત્રિત કરવા
૩૦.	હેડ ક્લાર્ક (સંકલન વિભાગ બોર્ડ કમિટી) ફાળવણી અન્ય ખાતે			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સ્ટે.કમિટી, સ્ટાફ સિલેક્શન કમિટી, ઓડીટ સબ કમિટી અપીલ કમિટી ની સંકલનની કામગીરી તથા તેના ઠરાવો તથા મૂળફાઈલ જુદા જુદા ખાતે આઉટવર્ડની કામગીરી
૩૧.	ડે.શિરસ્તેદાર (હેલ્થ / હોસ્પિટલ) સીનીયર ક્લાર્ક શાહ કલ્પેશ ભોગીલાલ			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	હેલ્થ ખાતામાં તથા હોસ્પિટલોમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૩ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસડેટા, બદલી, નિમણૂક બઢતી અંગેની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
	એમ્પ.નં-૮૧૬૯				
૩૨.	ડે.શિરસ્તેદાર (પોર્ટ ફોલીયો) સીનીયર કલાર્ક મંગેશ આર તાવડે એમ્પ.નં-૮૭૯૬			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસ દ્વારા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ જરૂરી મંજૂરી અર્થે મુકવામાં આવતી ફાઇલોનું ઈન્વર્ડ આઉટવર્ડ તથા ડીપાર્ટમેન્ટલ પરીક્ષાનું આયોજન
૩૩.	સીનીયર કલાર્ક સંકલન વિભાગ બોર્ડ કમિટી શ્રી ધર્મેશભાઈ શાહ એમ્પ્લોઈ નં. ૬૯૩૧			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટાઉન પ્લાનીંગ કમિટી, એસ્ટેટ કમિટી, હાઉસીંગ કમિટી, રીક્રીએશન કમિટીમાં સંકલનની કામગીરી
૩૪.	સીનીયર કલાર્ક ઈન્ટરવ્યુ વિભાગ શ્રી મનીષ પંચાલ એમ્પ્લોઈ નં. ૮૭૮૮ (ફાળવણી)			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતાના જુદા જુદા ખાતાની જાહેર ખબરના અનુસંધાને આવેલ અરજીઓની લાયકાત મુજબ ચકાસણી કરવાની, તેમજ તે અંગે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી ઈન્ટરવ્યુ ગોઠવવાની કામગીરી, ઈન્ટરવ્યુમાં આવેલ ઉમેદવારોના અસલ સર્ટિફિકેટ ચેક કરવાની કામગીરી, તેમજ ઈન્ટરવ્યુ બાદ સ્ટાફ સિલેક્શન કમિટીની સૂચના મુજબ પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવી સ્ટાફ સિલેક્શન ઠરાવ પાડવાની કામગીરી તથા ઉમેદવારોને કોલ લેટર લખવાની તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક કેડરના પ્રવિઝનલ સીનીયોરીટી લીસ્ટ તથા ફાયનલ સીનીયોરીટી લીસ્ટ તૈયાર કરવાની કામગીરી
૩૫.	સીનીયર બીલ કલાર્ક શ્રી જયેશભાઈ પટેલ એમ્પ્લોઈ નં. ૮૨૬૯			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસની જરૂરીયાત મુજબની કન્ટ્રીજન્સી ઈન્ડેન્ટ ભરીને સેન્ટ્રલ સ્ટોર્સમાંથી લાવવાની, અધિકારી / કર્મચારીને કન્ટ્રીજન્સી જરૂરીયાત મુજબ રજીસ્ટરમાં નોંધ કરીને ઈસ્યુ કરવાની કામગીરી, પાર્ટીઓના બીલો માટે મંજૂરી લઈ બીલ બનાવી પેમેન્ટ કરવાની કામગીરી, રાજ્ય સરકારમાંથી ડેપ્યુટેશન ઉપર આવેલ મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીના પગારમાંથી કપાત કરવામાં આવેલ પ્રો.ફંડ, જી.આઈ.એસ, એચ.બી.એ, એચ.આર.આર વિગેરે ચિલણો બનાવી સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવાની કામગીરી
૩૬.	જુનીયર કલાર્ક રજીસ્ટ્રી બ્રાંચ શ્રી મહાવીર ટી. રાઠોડ એમ્પ્લોઈ નં. ૭૨૧૯૩			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	વહીવટી કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૩ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસડેટા, બદલી, નિમણૂક બઢતી અંગેની કામગીરી તથા ખાતાધિકારીશ્રી દ્વારા જે કામગીરી સોંપવામાં આવે તે કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
૩૭.	જુનીયર ક્લાર્ક રજીસ્ટ્રી બ્રાંચ શ્રી જનક શુક્લ એમ્પ્લોઈ નં. ૭૩૨૪૯			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા મ્યુનિ.કમ્પાઉન્ડમાં ફરજ બજાવતા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને આવતા ખાનગીપત્રો, મુખ્યમંત્રીશ્રીના પત્રો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ નાપત્રો, સરકારીપત્રો, વિધાનસભાના તારાંકીતપ્રશ્નો, પ્રભારી સચિવ કલેક્ટરશ્રીના આવતા પત્રો, સ્વાગતમ માન્ય મુખ્યમંત્રીશ્રીના પત્રોનું ઇન્વર્ડ આઉટવર્ડની કામગીરી
૩૮.	જુનીયર ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર હેમંત ચવ્ડાણ એમ્પ્લોઈ નં. ૭૨૬૦૯ જી.ડી.ઈએસટી.બ્રાચ			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની નિમણૂક, બદલી, બઢતી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફેરફાર, રાજીનામા, સ્વૈ.નિવૃત્તિ, જી.ડી.ઈએસટી.નંબર પાડી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પ્યુટરાઈઝડ કરવાની કામગીરી
૩૯.	ડીટીપી ઓપરેટર રજીસ્ટ્રી બ્રાંચ શ્રી સોલંકી હેમાંગીની હરીશભાઈ એમ્પ્લોઈ નં. ૯૨૩૨			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને ખાતા દ્વારા જરૂરી મંજૂરી અર્થે આવતી ફાઈલોનું / પત્રોનું ઇન્વર્ડ / આઉટવર્ડ
૪૦.	સીનીયર.ક્લાર્ક રજીસ્ટ્રી બ્રાચ શ્રી મનીષ પંચાલ એમ્પ્લોઈ નં. ૮૭૮૮			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા મ્યુનિ.કમ્પાઉન્ડમાં ફરજ બજાવતા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને પોસ્ટ, કુરીયરથી આવતી અરજી / પત્રો, ખાતાકીય પત્રો, મેયરશ્રી તથા ડે.મેયરશ્રી તરફથી આવતા પત્રો, ચેરમેન સ્ટે.કમિટીશ્રીના પત્રોનું ઇન્વર્ડ આઉટવર્ડની કામગીરી
૪૧.	જુ.ક્લાર્ક રજીસ્ટ્રી બ્રાચ શ્રી મો આમીર એમ અબ્બાસી એમ્પ્લોઈ નં. ૮૭૯૨			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા મ્યુનિ.કમ્પાઉન્ડમાં ફરજ બજાવતા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને પોસ્ટ, કુરીયરથી આવતી અરજી / પત્રો, ખાતાકીય પત્રો, મેયરશ્રી તથા ડે.મેયરશ્રી તરફથી આવતા પત્રો, ચેરમેન સ્ટે.કમિટીશ્રીના પત્રોનું ઇન્વર્ડ આઉટવર્ડની કામગીરી
૪૨.	જુ.ક્લાર્ક રજીસ્ટ્રી બ્રાંચ શ્રી પ્રવિણકુમાર એ સોલંકી એમ્પ્લોઈ નં. ૯૩૭૩			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ડે.મ્યુનિસિપલ કમિશનર (ટેક્) શ્રીને સંબોધીને ખાતા દ્વારા જરૂરી મંજૂરી અર્થે આવતી ફાઈલોનું / પત્રોનું ઇન્વર્ડ / આઉટવર્ડ
૪૩.	જુ.ક્લાર્ક કમ્પ્યુટર			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય	સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની નિમણૂક, બદલી, બઢતી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફેરફાર, રાજીનામા,


અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
	જી.ડી.ઈએસટી.બ્રાય શ્રી જીજ્ઞેશ આર.મોદી એમ્પ્લોઈ નં. ૯૮૨૫			કામગીરીઓ	સ્વૈ.નિવૃત્તિ, જી.ડી.ઈએસટી.નંબર પાડી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પ્યુટરાઈઝડ કરવાની કામગીરી
૪૪.	જી. કોમ્પ્યુટર ઓપરેટર કમ્પ્યુટર જી.ડી.ઈએસટી.બ્રાય શ્રી બીમલકુમાર કે રામપરીયા એમ્પ્લોઈ નં. ૭૨૬૦૭			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની નિમણૂક, બદલી, બઢતી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફેરફાર, રાજીનામા, સ્વૈ.નિવૃત્તિ, જી.ડી.ઈએસટી.નંબર પાડી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પ્યુટરાઈઝડ કરવાની કામગીરી
૪૫.	સીની કલાર્ક રોસ્ટર વિભાગ શ્રી પુંઠાવાલા અફરોઝબાનુ એમ્પ્લોઈ નં. ૮૪૯૭			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાની વર્ગ ૧ થી ૪ ની જગ્યાઓના રોસ્ટર રજીસ્ટર નિભાવવા, જાળવણી કરવી વખતો વખત થતી નિમણૂક, રાજીનામા, બઢતી મૃત્યુ વગેરેની નોંધ કરી રજીસ્ટર અપડેટ કરવા. તેમજ બેકલોગની જાહેર ખબર આપવી. નવી જગ્યા ભરવા રોસ્ટર અભિપ્રાય આપવા. રાજ્ય સરકાર દ્વારા રોસ્ટરને લગતી માહિતી માંગવામાં આવે તે માહિતી સમયસર પૂરી પાડવાની કામગીરી તેમજ રૂા.૧૦૦૦૦/- ની મર્યાદા સુધી અધિકારી / કર્મચારીને મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી મેળવી સેમીનારમાં મોકલવાની કામગીરી તેમજ સેમીનાર અંગે દરખાસ્ત કરવાની કામગીરી
૪૬.	જી.કલાર્ક શ્રી રાહુલભાઈ પ્રજાપતી એમ્પ્લોઈ નં.૭૨૪૮૭ ફાળવણીથી નિમણૂક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	રોડ પ્રોજેક્ટના ઓર્ડરો તથા સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની નિમણૂક, બદલી, બઢતી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફેરફાર, રાજીનામા, સ્વૈ.નિવૃત્તિ, જી.ડી.ઈએસટી.નંબર પાડી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પ્યુટરાઈઝડ કરવાની કામગીરી
૪૭.	જી.કલાર્ક શ્રી મનીષ ડી મોદી એમ્પ્લોઈ નં. ૯૫૬૩ ફાળવણીથી નિમણૂક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	હેલ્થ ખાતામાં તથા હોસ્પિટલોમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૩ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસડેટા, બદલી, નિમણૂક બઢતી અંગેની કામગીરી
૪૮.	જી.કલાર્ક શ્રી વિપુલ પટેલ એમ્પ્લોઈ નં. ૯૫૬૬ ફાળવણીથી નિમણૂક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટેકનીકલ કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૩ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસડેટા, બદલી, નિમણૂક બઢતી અંગેની કામગીરી
૪૯.	જી.કલાર્ક(સીક્યુરીટી) શ્રી પિયુષ કે પારેખ			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય	જુદી જુદી સીક્યુરીટી કંપનીના આવતા બીલોની પોઈન્ટ વાઈઝ ચકાસણી કરીને ખતવણી કરવાની કામગીરી, બીલોનું સ્ટેટમેન્ટ બનાવવાની કામગીરી,

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
	એમ્પ્લોઈ નં ૪૨૦૦૬ ફાળવણીથી નિમણુંક			કામગીરીઓ	જરૂરીયાત મુજબ જે તે જગ્યાએ સીક્યુરીટી મુકવા તેમજ બંધ કરવા સીક્યુરીટી કંપનીને જાણ કરવા તેમજ એસ્ટેટ / ટી.ડી.ઓ ખાતા દ્વારા ગેરકાયદેસર બાંધકામ માટે મુકવામાં આવતી સીક્યુરીટી અંગેનો ચાર્જ વસૂલ લેવા અંગેની ગણતરી કરી ટી.ડી.ઓ / એસ્ટેટ ખાતાને જાણ કરવી.તેમજ બીલો બનાવવા.
૫૦.	જી.કલાર્ક(સંકલન) શ્રી કમલેશ સોલંકી એમ્પ્લોઈ નં. ૮૧૨૪૨ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	કમિટીની ફાઇલો ઈન્વર્ડ કરવા તથા ડિસ્પેચ કરવા તેમજ કમિટીઓ એટેન્ડ કરવાની કામગીરી
૫૧.	જી. કોમ્પ્યુટર ઓપરેટર કમ્પ્યુટર જી.ડી.ઈએસટી.બ્રાચ શ્રી પ્રવિણ સાવલીયા એમ્પ્લોઈ નં. ૭૨૬૨૦ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની નિમણુંક, બદલી, બઢતી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફેરફાર, રાજીનામા, સ્વે.નિવૃત્તિ, જી.ડી.ઈએસટી.નંબર પાડી વેબસાઇટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પ્યુટરાઈઝડ કરવાની કામગીરી
૫૨.	સીનીયર કલાર્ક - વેલ્ફેર બ્રાંચ શ્રી ગૌતમભાઈ ભાવસાર એમ્પ્લોઈ નં. ૬૮૧૭ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીના આશ્રિતને રાજ્ય સરકારના નીતી નિયમો અનુસાર નાણાંકિય સહાય આપવા મંજૂરી મેળવવાની કામગીરી તથા મેનહોલ/ગલીટ્રેપ ખાતાના વર્ગ-૪ના કર્મચારીઓના મરણ/ અનફિટ કેસમાં નોકરી આપવા અંગે
૫૩.	જુનીયર કલાર્ક - વેલ્ફેર બ્રાંચ શ્રી એમ્પ્લોઈ નં. ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીના આશ્રિતને રાજ્ય સરકારના નીતી નિયમો અનુસાર નાણાંકિય સહાય આપવા મંજૂરી મેળવવાની કામગીરી તથા મેનહોલ/ગલીટ્રેપ ખાતાના વર્ગ-૪ના કર્મચારીઓના મરણ/ અનફિટ કેસમાં નોકરી આપવા અંગે
૫૪.	જી.કલાર્ક શ્રી સતિષ મોદી ઈન્ટરવ્યુ બ્રાંચ એમ્પ્લોઈ નં. ૮૩૮૬ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ડે.મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) શ્રીને સંબોધીને ખાતા દ્વારા જરૂરી મંજૂરી અર્થે આવતી ફાઇલોનું / પત્રોનું ઈન્વર્ડ / આઉટવર્ડ
૫૫.	સીની.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી નટુભાઈ પ્રજાપતિ			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	અરજદારની અરજીઓની ચકાસણી કરેલ પત્રક તથા સુધારા પત્રકની નવી નકલ સીની.કલાર્કને સુપ્રત કરવાની

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંણાકીય સત્તા	અન્ય	ફરજો
	એમ્પ્લોઈ નં. ૮૮૫૩ ફાળવણીથી નિમણુંક				
૫૬.	જી.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી સંજય પટેલ એમ્પ્લોઈ નં. ૭૨૮૨૪ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	જાહેરખબરની નકલ એકાઉન્ટ ખાતામાં મોકલવી તથા જાહેરત રજીસ્ટર મેઈનટેઈન કરવું પસંદગી/પ્રતિક્ષાયાદીના ઠરાવનુ રજીસ્ટર મેઈનટેઈન કરવું.
૫૭.	જી.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી કનુભાઈ વી દેસાઈ એમ્પ્લોઈ નં. ૮૬૦૮ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સીનીયોરીટી લીસ્ટ બનાવવા તથા આરટીઆઈ બાબતની કામગીરી
૫૮.	જી.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી કોમલ ડોરીયા એમ્પ્લોઈ નં. ૮૪૧૮ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ઉમેદવારોની અરજી અંગેના જવાબો, સરકારી પત્રોના જવાબો, મેરીટયાદી તૈયાર કરવી ડેટા એન્ટ્રી તેમજ કમ્પ્યુટરને લગતી અન્ય કામગીરી
૫૯.	જી.કલાર્ક શ્રી રમીઝ આર વોરા એમ્પ્લોઈ નં. ૭૩૦૮૮ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસ દ્વારા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ જરૂરી મંજૂરી અર્થે મુકવામાં આવતી ફાઈલોનું ઈન્વર્ડ આઉટવર્ડ તથા ડે.શિરસ્તેદાર(હોસ્પિટલ-હેલ્થ)ની મદદમાં
૬૦.	ઝેરોક્ષ ઓપરેટર શ્રી નવીનભાઈ ગામેતી એમ્પ્લોઈ નં. ૩૫૬૦૮ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ઝેરોક્ષ મશીન ઓપરેટીંગ તેમજ તેના રીપેરીંગ અંગે જાણ કરવાની કામગીરી

3.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
ફાઈલ / અરજીનો નિકાલ કરવા માટે નિર્ણય કરવાની પદ્ધતિ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
પ્રકરણ - ૪ (નિયમ સંગ્રહ - ૩)
કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ
નિયમસંગ્રહ અને દફતરો

૪.૧	દસ્તાવેજનું નામ / મથાળું	-:	અધિકારીઓ / કર્મચારીઓની મહેકમ અંગે કામગીરી
	દસ્તાવેજનો પ્રકાર	-:	દફતરો
	દસ્તાવેજ પરનું ટુકું લખાણ	-:	મહેકમ સંબધી
	દફતરોની નકલ અહીંથી મળી શકશે	-:	આસી.મેનેજર શ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ અમદાવાદ ૧ ટેલીફોન નંબર ૨૫૩૯૧૮૧૧ થી ૧૮૧૮ એક્ષટેન્શન નંબર : ૫૪૪ ફેક્સ નંબર ૨૫૩૫૦૮૨૬
	વિભાગ દ્વારા નિયમો, વિનિયમો, સૂચનાઓ	-:	૧. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહેકમ સંબધી વિનિયમો ૨. મહાનગરપાલીકાના નિયમો ૩. રહેમરાહે નોકરીના નિયમો ૪. રોસ્ટરના નિયમો ૫. સ્ટે.કમિટી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડના ઠરાવો. ૬. સીનીયોરીટી લીસ્ટ કેડરવાઈઝ
	નિયમ સંગ્રહ અને દફતરોની નકલ માટે લેવાતી ફી	-:	નિયમોનુસાર



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
પ્રકરણ ૫ (નિયમ સંગ્રહ - ૪)

નીતી ધડતર અથવા નીતીના અમલ સંબધી જનતાના સભ્યો સાથે
સલાહ - પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની
કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત

અનુ નં	વિષય / મુદ્દો	શું જનતાની સહભાગીતા સનિશ્ચિત કરવાનું જરૂરી છે ? (હા / ના)	જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા
૧	મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસની કામગીરી	ના	આ વિભાગની કામગીરી અધિકારી / કર્મચારીઓની મહેકમ સંબધીત કામગીરી છે જે આમ જનતાને સ્પર્શતી નથી.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ

૫.
રૂલ્સ / રેગ્યુલેશન / સૂચનાઓ / મેન્યુઅલ / રેકર્ડ પેકી રાખવામાં આવતા રેકર્ડની માહિતી

અનુ નં	વિગત	પ્રાપ્તિ સ્થાન
૧.	સરકયુલર	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી www.egovamc.com તથા ડીસે ૨૦૧૫ થી www. Ahmedabadcity.gov.in ઉપરથી મળી શકશે.
૨.	ઓફીસ ઓર્ડર	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી www.egovamc.com તથા ડીસે ૨૦૧૫ થી www. Ahmedabadcity.gov.in ઉપરથી મળી શકશે.
૩.	જી.ડી.ઇએસટી.ઠરાવો	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી www.egovamc.com તથા ડીસે ૨૦૧૫ થી www. Ahmedabadcity.gov.in ઉપરથી મળી શકશે.
૪.	ફાયનલ તથા પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી www.egovamc.com તથા ડીસે ૨૦૧૫ થી www. Ahmedabadcity.gov.in ઉપરથી મળી શકશે.
૫.	ભરતી સંબંધિત પરિણામો	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી www.egovamc.com તથા ડીસે ૨૦૧૫ થી www. Ahmedabadcity.gov.in ઉપરથી મળી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ

પ્રકરણ ૬ (નિયમ સંગ્રહ ૫)

જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજની કક્ષાઓ અંગેનું પત્રક

અનુ નં	દસ્તાવેજની કક્ષા	દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ	દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ	નીચેની વ્યક્તિ પાસે છે / તેના નિયંત્રણમાં છે.
૧	દફતરો	અમદાવાદ મહાનગરપાલીકાના મહેકમ સંબધી વિનિયમો	નિયમાનુસાર	શિરસ્તેદારશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
૨	દફતરો	અમદાવાદ મહાનગરપાલીકાના વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓના નિમણૂક / બદલી / બદતી / ફાળવણી / તેમજ અન્ય હુકમો (વર્ગ ૪ માં હેલ્થ તેમજ ઈજનેર ખાતા સિવાય)	“	શિરસ્તેદારશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
૩	દફતરો	અમદાવાદ મહાનગરપાલીકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા ડે.મ્યુનિસિપલ કમિશનર(વહીવટ) શ્રી દ્વારા કરવામાં આવતા સરકયુલરો તેમજ ઓફીસ ઓર્ડર	“	શિરસ્તેદારશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
૪	દફતરો	રહેમરાહે નોકરીના નિયમો (સરકારશ્રીના નિયમો મુજબ) તથા ઉચ્ચક નાણાંકિય સહાય ચુકવવાના નિયમો	“	વેલ્ફેરઓફીસરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
૫	દફતરો	રોસ્ટરના નિયમો (સરકારશ્રીના નિયમો મુજબ)	“	શિરસ્તેદારશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
૬	દફતરો	મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સ્ટે.કમિટી દ્વારા કરવામાં આવતા ઠરાવો મુજબ અમલીકરણ	“	સંકલન અધિકારીશ્રી (બોર્ડ - કમિટી વિભાગ / રોસ્ટર)
૭	દફતરો	સીનીયોરીટી લીસ્ટ કેડરવાઈઝ	“	ઓફીસ સુપ્રિ.શ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ
પ્રકરણ ૧૦ : અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી - પુસ્તિકા : (ડીરેક્ટરી)

અનુ નં	એમ્પ્લોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈમેઇલ	સરનામું
				કચેરી	મોબાઇલ	ઘર			
૧.	૧૩	શ્રી મુકેશ કુમાર આઈ.એ.એસ	મ્યુનિસિપલ કમિશનર	૨૫૩૫૨૮૨૮	---		---	--	
૨.	૧૮૨	શ્રી રોકેશશંકર , આઈ.એ.એસ	ડે.મ્યુનિસિપલ કમિશનર (મ.ઝોન)	૨૫૩૯૧૮૧૧/ એક્સ ૪૦૮	૯૭૨૭૭ ૬૪૯૧૯				
૩.	૧૮૩	ડૉ હર્ષિત વી ગોસાવી આઈ.એ.એસ	ડે.મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ / દ.ઝોન)	૨૫૪૬૨૨૫૨ ૨૫૪૬૫૨૫૫ એક્સ ૩૧૯ ૩૨૫ ૩૨૯૮૧૧૫૪	૯૦૯૯૪ ૦૬૦૦૦				
૪.	૧૮૦	શ્રી ડી એ શાહ, જી.એ.એસ	ડે.મ્યુનિસિપલ કમિશનર (નવા પ.ઝોન)	૨૬૮૪૧૨૦૧	૯૯૨૫૫ ૨૨૨૨૫				
૫.	૧૮૪	શ્રી એન જે માલવીયા, જી એ એસ	ડે.મ્યુનિસિપલ કમિશનર (ઉ.ઝોન / વહીવટ)	૨૨૮૦૦૮૦૩ ૨૨૮૪૨૯૨૬	૯૯૭૯૯ ૩૪૪૪૪				
૬.	૧૮૧	શ્રી જે એસ પ્રજાપતિ જી.એ.એસ	ડે.મ્યુનિસિપલ કમિશનર (પુર્વઝોન)		૯૯૨૫૫ ૨૨૨૨૪				
૭.	૧૦૩૮	શ્રી આર્જવભાઈ જે. શાહ	ડે.મ્યુનિસિપલ કમિશનર (ફાયનાન્સ/પ્લાનીંગ/એ એમટીએસ)	૨૨૧૭૩૫૮૧	૯૩૨૭૦૩૮૮૨૪	૨૭૪૬૬૩૧૮			૧૫, સમર્થ કો.ઓ.સો.લી., મેમનગર તળાવ પાસે, મેમનગર, અમદાવાદ
૮.	૧૬૬	શ્રી વિશાલ બી. ખનામા	આસી.મ્યુ.કમિશનર (નવા પ.ઝોન)		૯૩૭૭૫૯૮૮૫૮				૩૯, શાયોના દર્શન બંગ્લોઝ, ગુજરાત હાઈકોર્ટ સામે, ઘાટલોડીયા, અમદાવાદ
૯.	૧૬૮	શ્રી પટેલ સૌરભ દિલીપભાઈ	આસી.મ્યુ.કમિશનર (મ.ઝોન)		૯૩૭૭૪૦૯૬૭૪				૪૦૨, મનબીજ ફ્લેટ, સીપીનગર સામે, ઘાટલોડીયા, અમદાવાદ
૧૦.	૧૬૯	શ્રી શાહ પરાગ વિનોદકુમાર	આસી.મ્યુ.કમિશનર (દ.ઝોન / પૂર્વ ઝોન)		૯૩૭૭૫૯૮૮૫૭				૧૧, પાયલપાર્ક સોસાયટી, સ્ટાર ઈન્ડીયા બજાર પાસે, સેટેલાઈટ રોડ, અ-વાદ.
૧૧.	૧૭૦	શ્રી ભંડારી તેજસ જી.	આસી.મ્યુ.કમિશનર (પશ્ચિમ ઝોન)		૯૩૭૭૪૦૯૬૯૨				૧૧, પાયલપાર્ક સોસાયટી, સ્ટારબજાર પાસે, સેટેલાઈટ, અમદાવાદ
૧૨.	૧૭૧	શ્રી ભટ્ટ રમ્યકુમાર વી.	આસી.મ્યુ.કમિશનર (ઉ.ઝોન)		૯૩૭૭૪૦૯૬૪૬				સી/૩, ભાસ્કર એપાર્ટમેન્ટ, એસ બીઆઈ ક્વાર્ટર્સ, મીરામ્બીકા સ્કુલ

અનુ નં	એમ્લોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈમેઇલ	સરનામું
				કચેરી	મોબાઇલ	ઘર			
									રોડ, નારણપુરા, અમદાવાદ
૧૩.	૭૦૨૨૮	શ્રી નિલેષભાઈ સી પટેલ	આસી.મેનેજર	૨૫૩૯૧૮૧૧ એક્સ.૫૪૪	૯૩૨૭૫૫૪૯૦૩		૨૫૩૨૮૬૯૮	centraloffice@ahmedabadcity.gov.in	
૧૪.	૭૦૨૪૫	શ્રી કિરણકુમાર જે વનાલીયા	આસી.મેનેજર	૨૫૩૯૧૮૧૧ એક્સ.૭૩૦	૯૩૨૭૫૫૫૨૧૯		૨૫૩૨૮૬૯૮	"	
૧૫.	૮૦૫૧	શ્રી કાંતિભાઈ બી પ્રજાપતિ	શિરસ્તેદાર (ઓફિસ સુપ્રીટેન્ડન્ટ)	૨૫૩૯૧૮૧૧ એક્સ.૫૪૮	---			"	
૧૬.	૮૬૯૪	શ્રી ભરતભાઈ આર સોલંકી	સંકલન અધિકારી (બોર્ડ - કમિટી)	૨૫૩૯૧૮૧૧ એક્સ.૫૪૫	૯૮૭૯૦૩૧૭૬૮			"	
૧૭.	૮૫૭૯	શ્રી રઘુભાઈ એન પાંડેર	વેલ્ફેર ઓફીસર	૨૫૩૯૧૮૧૧ એક્સ.૫૯૮	૯૮૯૮૦૦૫૪૫૮			"	
૧૮.	૮૪૯૮	શ્રી વિજયભાઈ આર પટેલ	ઓ.એસ.	૨૫૩૯૧૮૧૧ એક્સ. ૭૩૦	૯૮૭૯૦૩૧૭૬૮			"	
૧૯.	૮૫૦૨	શ્રી દિપક એ કટારા	હેડ કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ	૨૫૩૯૧૮૧૧ એક્સ.૪૩૩					
૨૦.	૮૬૯૮	શ્રીમતિ ફાલ્ગુની વાય દેસાઈ	સીનીયર કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ						
૨૧.	૭૩૧૧૦	ક્રિસ્ટાઈન એસ. ક્રિશ્ચિયન	જુનીયર કલાર્ક						
૨૨.	૯૬૩૭	શ્રીમતી ભુમિકા પી દેસાઈ	જુનીયર કલાર્ક શિરસ્તેદાર રજીસ્ટ્રી બ્રાંચ						
૨૩.	૭૨૮૩૨	શ્રી અંકિત કાનડે ટેક્ષ ખાતે ફાળવણી	જુ.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ						
૨૪.	૭૨૧૯૩	શ્રી મહાવીર ટી. રાઠોડ	જુ.કલાર્ક	૨૫૩૯૧૮૧૧ એક્સ.૪૬૬					
૨૫.	૮૨૬૯	શ્રી જયેશ પટેલ	સીનીયર કલાર્ક ઈમ્પ્રોવેશ ક્ષેત્ર						
૨૬.	૯૨૪૨	શ્રી રજનીકાંત એચ પટેલ	સીનીયર કલાર્ક ડે.શિરસ્તેદાર (જનરલ)						
૨૭.	૮૧૬૧	શ્રી વિજય કે પંડયા	ઈન્ચાર્જ હેડ કલાર્ક (જનરલ)	૨૫૩૯૧૮૧૧ એક્સ.૪૫૬					
૨૮.	૯૩૫૯	શ્રી કલાવતી હરેન મહેતા	સીનીયર કલાર્ક એ.સી.આર બ્રાંચ તથા						

અનુ નં	એમ્પ્લોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈમેઇલ	સરનામું
				કચેરી	મોબાઇલ	ઘર			
			સરકયુલર, ઓફીસઓર્ડર						
૨૯.	૮૧૬૯	શાહ કલ્પેશ ભોગીલાલ	ડે.શિરસ્તેદાર (હેલ્થ / હોસ્પિટલ) સીનીયર કલાર્ક						
૩૦.	૬૮૨૦	શ્રી શૈલેષ કે. મોદી	સીનીયર કલાર્ક સીક્યુરીટી બ્રાંચ	૨૫૩૯૧૮૧૧ એક્સ.૫૯૬					
૩૧.	૮૭૯૬	શ્રી મંગેશ તાવડે	સી.કલાર્ક પાર્ટફોલીયો						
૩૨.	૭૩૪૦૧	શ્રી સલમાન ખાલીદી	જુ.કલાર્ક						
૩૩.	૮૫૯૮	શ્રી ધર્મેશ આર શાહ	સીનીયર કલાર્ક સંકલન વિભાગ બોર્ડ કમિટી	૨૫૩૯૧૮૧૧ એક્સ.૫૪૫					
૩૪.	૮૭૮૮	શ્રી મનિષ પંચાલ	સીનીયર કલાર્ક ઈન્ટરવ્યુ વિભાગ	૨૫૩૯૧૮૧૧ એક્સ.૬૫૦					
૩૫.	૮૨૬૯	શ્રી જયેશ પટેલ	સીનીયર બીલ કલાર્ક	૨૫૩૯૧૮૧૧ એક્સ.૭૫૮					
૩૬.	૯૧૧૪	શ્રી દિપેન ગાંધી	જુનીયર બીલ કલાર્ક	૨૫૩૯૧૮૧૧ એક્સ.૭૫૮					
૩૭.	૯૨૩૨	શ્રી સોલંકી હેમાગીની એચ	સીનીયર કલાર્ક કમિશનરશ્રીની ઓફીસ ઈન્વર્ડ	૨૫૩૯૧૮૧૧ એક્સ.૪૨૨					
૩૮.	૮૭૯૨	શ્રી મો આમીર એમ અબ્બાસી	જુ.કલાર્ક રજીસ્ટ્રી બ્રાચ	૨૫૩૯૧૮૧૧ એક્સ.૭૧૦					
૩૯.	૯૩૭૩	શ્રી પ્રવિણકુમાર એ સોલંકી	જુ.કલાર્ક રજીસ્ટ્રી બ્રાંચ	૨૫૩૯૧૮૧૧ એક્સ.૫૧૧					
૪૦.	૮૪૯૭	શ્રી અફરોઝખાનુ એ પુંઠાવાલા	સીની કલાર્ક રોસ્ટર વિભાગ						
૪૧.	૬૦૩૧૪	શ્રી ગણેશ એ પટેલ	એન્ટેન્ડેન્ટ કમ ડ્રાઇવર						
૪૨.	૯૮૨૫	શ્રી જીજ્ઞેશ આર.મોદી જી.ડી.ઈએસટી.બ્રાચ	જુ.કલાર્ક કમ્પ્યુટર						
૪૩.	૭૨૬૦૭	શ્રી બીમલ કે રામપરીયા	જુ.કમ્પ્યુટર ઓપરેટર જી.ડી.ઈએસટી.બ્રાચ						
૪૪.	૯૫૬૩	શ્રી મનિષભાઈ મોદી	જુ.કલાર્ક ફાળવણી						
૪૫.	૯૫૬૬	શ્રી વિપુલ પટેલ	જુ.કલાર્ક ફાળવણી						
૪૬.	૪૨૦૦૬	શ્રી પિયુષ પારેખ	જુ.કલાર્ક ફાળવણી						
૪૭.	૭૩૪૦૧	શ્રી સલમાન ખાલીદી	જુ.કલાર્ક ફાળવણી						

અનુ નં	એમ્લોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈમેઇલ	સરનામું
				કચેરી	મોબાઇલ	ઘર			
૪૮.	૭૨૬૨૦	શ્રી પ્રવિણ સાવલીયા	જુ.કમ્પ્યુટર ઓપરેટર ફાળવણી						
૪૯.	૬૮૧૭	શ્રી ગૌતમ બી. ભાવસાર	સીની. કલાર્ક ફાળવણી						
૫૦.	૯૩૮૬	શ્રી સતીષ મોદી	જુ. કલાર્ક ફાળવણી						
૫૧.	૮૮૫૩	શ્રી નટુભાઈ પ્રજાપતિ	સીનીયર કલાર્ક						
૫૨.	૭૨૮૨૪	શ્રી સંજય પટેલ	જુ. કલાર્ક ફાળવણી						
૫૩.	૭૩૦૯૮	શ્રી રમીઝ આર વોરા	જુ. કલાર્ક ફાળવણી						
૫૪.	૯૬૦૯	શ્રી કનુભાઈ વી દેસાઈ	જુ. કલાર્ક ફાળવણી						
૫૫.	૭૨૪૮૭	શ્રી રાહુલ પ્રજાપતિ	જુ. કલાર્ક ફાળવણી						
૫૬.	૯૪૧૮	શ્રી કોમલ ડોરીયા	જુ. કલાર્ક ફાળવણી						
૫૭.	૮૪૦૫	શ્રી ભરતભાઈ આઈ પટેલ	સીનીયર કલાર્ક						
૫૮.	૮૬૬૨	શ્રી અલ્પેશ એમ મહેતા	સીનીયર કલાર્ક						
૫૯.	૮૭૮૮	શ્રી મનીષ પંચાલ	સીનીયર કલાર્ક						
૬૦.	૯૯૩૨	શ્રી લલીત પટેલ	જુનીયર કલાર્ક						
૬૧.	૩૫૬૦૯	શ્રી નવીન ગામેતી	ઝેરોક્ષ ઓપરેટર						
૬૨.	૩૫૫૪૧	શ્રી રામભાઈ ઓ ભીલ	નાયક						
૬૩.	૩૫૫૪૫	શ્રી બાબુભાઈ ડી બરંડા	નાયક						
૬૪.	૪૧૨૨૪	શ્રી સોમાભાઈ એસ દેસાઈ	પટાવાળા						
૬૫.	૩૯૨૪૩	શ્રી રોહીત બી ઠાકોર	પટાવાળા						
૬૬.	૩૪૩૦૯	શ્રી ઈકબાલહુસૈન એમ. દિવાન	પટાવાળા						
૬૭.	૩૨૭૧૩	શ્રી હરીસિંહ જે સીસોદીયા	પટાવાળા						
૬૮.	૩૨૮૨૭	શ્રી અબ્દુલરહેમાન એમ મોદન	પટાવાળા						
૬૯.	૩૯૧૦૧	શ્રી ભાવેશ વી. દાતણીયા	પટાવાળા						
૭૦.	૩૪૩૮૭	શ્રી અબ્દુલરસીદ એ. કાદરભાઈ	પટાવાળા						
૭૧.	૩૪૩૮૮	શ્રી રામતીરથ માતાદીન કોરી	પટાવાળા						
૭૨.	૩૪૬૦૯	શ્રી રમેશ જી. પ્રજાપતી	પટાવાળા						
૭૩.	૩૪૬૩૨	શ્રી જસવંત સી. બારીયા	પટાવાળા						
૭૪.	૩૪૮૮૬	શ્રી અશોક એસ લુધવાણી	પટાવાળા						
૭૫.	૩૬૦૦૮	શ્રી સ્વંયપ્રકાશ બી શ્રીમાળી	પુજારી						
૭૬.	૩૫૪૯૬	શ્રી રાજેશકુમાર એચ લોધા	પટાવાળા						
૭૭.	૩૫૬૭૧	શ્રી હસમુખ એમ ભાટી	પટાવાળા						

અનુ નં	એમ્લોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈમેઇલ	સરનામું
				કચેરી	મોબાઇલ	ઘર			
૭૮.	૩૫૬૭૭	શ્રી દેવેન્દ્ર પી મુંધવા	પટાવાળા						
૭૯.	૩૫૭૧૮	શ્રી નરેન્દ્ર એમ ઠાકોર	પટાવાળા						
૮૦.	૩૬૦૦૩	શ્રી ભારતીબેન એમ ગોહેલ	એટેન્ડેન્ટ						
૮૧.	૩૬૦૦૪	શ્રી અશોકભાઈ પી રાઠોડ	એટેન્ડેન્ટ						
૮૨.	૩૬૦૦૫	શ્રી વિરેન્દ્રપ્રસાદ એસ કોરી	એટેન્ડેન્ટ						
૮૩.	૩૬૦૦૬	શ્રી નારાયણ એન તૈલી	એટેન્ડેન્ટ						
૮૪.	૩૯૧૩૭	શ્રી વિશાલ પી ભટ્ટી	પટાવાળા						
૮૫.	૩૯૧૭૧	શ્રી મિતેષ બી પરમાર	પટાવાળા						
૮૬.		શ્રી મહંમદહુસેન જે વોરા	ઈન્ચાર્જ હેડ ડ્રાયવર						
૮૭.	૫૯૦૭૬	શ્રી શંકરસિંહ એ ખારીરાવત	ડ્રાયવર						
૮૮.	૩૨૮૯૫	શ્રી બાબુભાઈ વી પરમાર	ડ્રાયવર						
૮૯.	૩૨૯૯૫	શ્રી ઈશ્વરભાઈ આર દેસાઈ	ડ્રાયવર						
૯૦.	૩૫૨૩૯	શ્રી ભરતભાઈ આઈ ઠાકોર	ડ્રાયવર						
૯૧.	૫૯૭૮૮	શ્રી બળવંત ભીમસીંગ ગામીત	ડ્રાયવર						
૯૨.	૩૪૮૨૬	શ્રી હીરાભાઈ જી વાઘેલા	ક્લીનર						
૯૩.	૬૦૩૧૫	શ્રી હસમુખ બી નાયક	ક્લીનર						
૯૪.		જગ્યા ખાલી	હેડ વોચમેન						
૯૫.	૩૨૮૨૨	શ્રી રમેશચંદ્ર એમ પારેખ	વોચમેન						
૯૬.	૩૯૭૧૭	શ્રી કેતન વી ચાવડા	વોચમેન						
૯૭.	૮૭૦૬	શ્રી મુકેશ એમ ચૌધરી	વોચમેન						



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ

પ્રકરણ ૧૧ (નિયમ સંગ્રહ - ૧૦)વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પધ્ધતિ સહીત

દરેક અધિકારી અને કર્મચારી હોદ્દા મુજબ મળતું માસિક મહેનતાણું

અનુ નં	હોદ્દો	લેવલ + પે મેટ્રીક્સ + ડી.એ ૪% (સાતમા પગાર પંચ મુજબ)
૧.	મ્યુનિસિપલ કમિશનર	લેવલ ૧૪ + ૧૪૪૨૦૦ / ૨૧૮૨૦૦
૨.	ડે.મ્યુનિસિપલ કમિશનર	લેવલ ૧૪ + ૧૪૪૨૦૦ / ૨૧૮૨૦૦
૩.	ડે.મ્યુનિસિપલ કમિશનર	લેવલ ૧૩ + ૧૧૮૫૦૦ / ૨૧૪૧૦૦
૪.	ડે.મ્યુનિસિપલ કમિશનર (રાજ્ય સરકારમાંથી પ્રતિનિયુક્તિ)	લેવલ ૧૨ + ૭૮૮૦૦ / ૨૦૮૨૦૦
૫.	ઓફિસર ઓન સ્પે. ડ્યુટી	લેવલ ૧૨ + ૭૮૮૦૦ / ૨૦૮૨૦૦
૬.	આસી.મ્યુનિસિપલ કમિશનર	લેવલ ૧૨ + ૭૮૮૦૦ / ૨૦૮૨૦૦
૭.	આસી.મેનેજર	લેવલ ૮ + ૫૩૧૦૦ / ૧૬૭૮૦૦
૮.	શિરસ્તેદાર (ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ), સંકલન અધિકારી, વેલ્ફેર ઓફીસર , ઓ.એસ.	લેવલ ૮ + ૪૪૮૦૦ + ૧૪૨૪૦૦
૯.	હેડ કલાર્ક	લેવલ ૬ + ૩૫૪૦૦ / ૧૧૨૪૦૦
૧૦.	સીનીયર કલાર્ક	લેવલ ૪ + ૨૫૫૦૦ / ૮૧૧૦૦
૧૧.	જુ.કલાર્ક	લેવલ ૨ + ૧૮૮૦૦ / ૬૩૨૦૦
૧૨.	જુ.કોમ્પ્યુટર ઓપેરટર	લેવલ ૨ + ૧૮૮૦૦ / ૬૩૨૦૦
૧૩.	હેડ ડ્રાયવર	લેવલ ૪ + ૨૫૫૦૦ / ૮૧૧૦૦
૧૪.	ડ્રાઈવર	લેવલ ૨ + ૧૮૮૦૦ / ૬૩૨૦૦
૧૫.	એટેન્ડેન્ટ	IS + ૧૪૮૦૦ / ૪૭૧૦૦
૧૬.	નાયક	IS - ૩ + ૧૫૭૦૦ / ૫૦૦૦૦
૧૭.	પુજારી	IS - ૩ + ૧૫૭૦૦ / ૫૦૦૦૦
૧૮.	કલીનર	IS + ૧૪૮૦૦ / ૪૭૧૦૦
૧૯.	હેડ વોચમેન	લેવલ ૨ + ૧૮૮૦૦ / ૬૩૨૦૦
૨૦.	વોચમેન	IS + ૧૪૮૦૦ / ૪૭૧૦૦
૨૧.	પગી	IS + ૧૪૮૦૦ / ૪૭૧૦૦
૨૨.	સીક્યુરીટી સુપ્રિટેન્ડેન્ટ	લેવલ ૮ + ૫૩૧૦૦ / ૧૬૭૮૦૦
૨૩.	પટાવાળા	IS + ૧૪૮૦૦ / ૪૭૧૦૦



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ

પ્રકરણ ૧૨ : (નિયમ સંગ્રહ ૧૧) પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર

તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ ચૂકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ, નિર્માણ અને તકનીકી કાર્યો અંગે જવાબદાર જાહેરતંત્ર માટે ૧૨.૧ જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહિતી

મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ

પગાર ખર્ચની (વર્ષ-૨૦૧૭-૧૮)

૧૦૩ મ્યુનિસિપલ કમિશનરશ્રીનું પર્સનલ

બજેટ કોડ નંબર	બજેટ હેડ	સૂચિત અંદાજપત્ર	મંજૂર થયેલ અંદાજપત્ર	તા.૩૦.૦૬.૧૭ સુધી થયેલ ખર્ચ	બાકી રહેલ ખર્ચ
૩૦૧૯૯	પગાર ખર્ચ	-	૧૫.૮૮	૬.૦૮	૯.૮૦
૩૪૮૨૦	ડીસ્ક્રીશનલ કન્ટ્રીજન્સી	-	૨૨.૦૦	૧.૯૫	૨૦.૦૫



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ

પ્રકરણ ૧૨ : (નિયમ સંગ્રહ ૧૧) પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર

તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ ચૂકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ, નિર્માણ અને તકનીકી કાર્યો અંગે જવાબદાર જાહેરતંત્ર માટે ૧૨.૧ જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહિતી

૧૦૪ મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ

બજેટ કોડ નંબર	બજેટ હેડ	સૂચિત અંદાજપત્ર	મંજૂર થયેલ અંદાજપત્ર	તા.૩૦.૦૬.૧૭ સુધી થયેલ ખર્ચ	બાકી રહેલ ખર્ચ
૩૦૧૯૯	પગાર ખર્ચ	-	૪૪૦.૬૦	૧૫૫.૬૮	૨૮૪.૯૨
૩૦૪૦૧	યુનીફોર્મ	-	૧.૦૦	૦.૦૦	૧.૦૦
૩૪૧૦૧	ટેલીફોન તથા ટ્રંકકોલ	-	૧૧.૦૦	૧.૯૨	૯.૦૮
૩૪૧૦૨	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	-	૨.૦૦	૦.૦૦	૨.૦૦
૩૪૧૦૩	મેમ્બરશીપ ફી	-	૩.૦૦	૦.૦૦	૩.૦૦
૩૪૨૨૦	સીટી મેનેજર્સ એસોસીયેશન	-	૩.૫૦	૦.૦૦	૩.૫૦
૩૪૪૦૧	સ્ટેશનરી	-	૩.૦૦	૦.૧૮	૨.૮૨
૩૪૪૦૪	પ્રીન્ટીંગ	-	૧.૦૦	૦.૦૬	૦.૯૪
૩૪૫૦૨	મુસાફરી ખર્ચ	-	૩૦.૦૦	૦.૬૯	૨૯.૩૧
૩૪૮૦૬	સીક્યુરીટી ખર્ચ	-	૨૪૫૭.૦૨	૨૯૫.૧૬	૨૧૬૧.૮૬
૩૪૮૦૮	પુસ્તકો અખબારો, સામયીકો, રમકડા	-	૦.૫૦	૦.૦૦	૦.૫૦
૩૪૮૧૩	ઓળખપત્રો	-	૦.૨૦	૦.૦૦	૦.૨૦
૩૮૭૦૭	સંદેશા વ્યહવારના સાધનો, ટેલીફોન વાયરલેસ	-	૫.૦૦	૦.૭૦	૪.૩૦
૩૯૦૦૧	ટેબલ ખુરશી	-	૧.૦૦	૦.૦૦	૧.૦૦
૩૪૮૯૯	અન્ય ખર્ચ	-	૨૨.૦૦	૧.૫૮	૨૦.૪૨
૩૪૩૦૩	મોટર તથા ટ્રાન્સપોર્ટ	-	૭.૦૦	૧.૫૨	૫.૪૮
૩૯૨૦૧	વાહન ખર્ચ	-	૮.૦૦	૧.૮૬	૬.૧૪
૪૩૨૦૧	પેટ્રોલ ડીઝલ ખર્ચ	-	૪૪.૭૧	૫.૦૮	૩૯.૬૩



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ

જાહેર માહિતી અધિકારીશ્રી ના નામ, હોદ્દો અને અન્ય માહિતી
મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસના અપીલ અધિકારી / જાહેર માહિતી અધિકારી / મદદનીશ માહિતી અધિકારીશ્રીની વિગતો

ક્રમ	સેન્ટ્રલ ઓફીસના વિભાગનું નામ	જાહેર માહિતી અધિકારી	અપીલ અધિકારી
૧	શિરસ્તેદારબ્રાંચ, હેડ ક્લાર્ક (જનરલ) બ્રાંચ, રજીસ્ટ્રી બ્રાંચ, સંકલન વિભાગ (બોર્ડ / કમિટી), રોસ્ટરવિભાગ , હેડ ડ્રાઇવર વિભાગ, કંટ્રોલરૂમવહીવટી બાબતો માટે (મોનસુન કંટ્રોલરૂમ સિવાય)	શ્રી નિલેષ સી પટેલ મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ, સી-બ્લોક પ્રથમ માળ, સરદાર પટેલ ભવન દાણાપીઠ, અમદાવાદ. centraloffice@ahmedabadcity.gov.in (ઓ) ૨૫૩૮૧૮૧૧ (૫૪૪) (મો) ૮૩૨૭૫ ૫૪૮૦૩	શ્રી સૌરભ પટેલ આસી મ્યુનિસિપલ કમિશનર (મધ્યઝોન) આસી મ્યુનિસિપલ કમિશનર (મ.ઝોન)શ્રીની ઓફીસ બી બ્લોક, નવુ બિલ્ડીંગ ત્રીજો માળ, સરદાર પટેલ ભવન, અ.મ્યુ.કોર્પોરેશન દાણાપીઠ અમદાવાદ saurabhpatel@ahmedabadcity.govi.in (ઓ) ૨૫૩૮૧૮૧૧ (૭૫૪) (મો)
૨	ઈન્ટરવ્યુ બ્રાંચ, વેલ્ફેર બ્રાંચ, સિક્યુરીટી બ્રાંચ તેમજ સેમીનાર તાલીમ, બીલ ક્લાર્ક અને ઈમ્પ્રેશ કેશ વિભાગ, વોચમેન બ્રાંચ	શ્રી કિરણ વનાલીયા મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ, સી-બ્લોક પ્રથમ માળ, સરદાર પટેલ ભવન દાણાપીઠ, અમદાવાદ. kiranvanaliya@ahmedabadcity.gov.in (ઓ) ૨૫૩૮૧૮૧૧ (૭૩૦) (મો) ૮૩૨૭૫ ૫૫૨૧૮	

સેન્ટ્રલ ઓફીસના જે તે વિભાગની માહિતી માટે જે તે વિભાગના જાહેર માહિતી અધિકારીશ્રીને સંબોધીને અરજી કરવાની રહેશે.